

ત્વરિત જાહેરાત માટે

## લંબાવેલ સીટી ક્લોઝર્સ અને કેન્સલેશન્સનું પરિણામ નોન-એસેન્શિયલ સર્વિસીસમાં રોજગાર હંગામી ધોરણે સ્થગિત થવાનું આવ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 17, 2020) – COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સગવડો બંધ રાખવાના અને કાર્યક્રમો રદ થવાનું લંબાવવાના પરિણામ સ્વરૂપે, સીટી ઓફ બ્રેમ્પટને એપ્રિલ 18, 2020 થી અમલમાં આવે તેમ નોન-એસેન્શિયલ (બિન-અનિવાર્ય) અને નોન-ક્રિટિકલ (બિન-નિર્ણાયક) સર્વિસીસમાં લગભગ 2,000 પાર્ટ-ટાઇમ, હંગામી (ટેમ્પરરી)/પ્રાસંગિક (ક્રુચ્યુઅલ), અને ઋતુલક્ષી (સીઝનલ) કર્મચારીઓનો રોજગાર હંગામી ધોરણે સ્થગિત કરવાનો મુશ્કેલભર્યો નિર્ણય લીધો છે.

આ એક હંગામી પગલું છે અને સીટીને આશા છે કે અમે વિવિધ કાર્યક્રમો અને સેવાઓ ફરી શરૂ કરી શકીએ એટલે તરત આ કર્મચારીઓ શહેરમાં પરત ફરશે.

વયગાળાના અત્યારના સમયમાં, સીટી પ્રભાવિત કર્મચારીઓને સહાયતા સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ રહે છે અને અપેક્ષા રાખે છે કે ઘણાં લોકો ગવર્નમેન્ટ ઓફ કેનેડાના બેનિફિટ પ્રોગ્રામ્સમાંથી નાણાકીય સહાયતા મેળવવાને પાત્ર બનશે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસ અને પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, સીટીએ ઘોષણા કરી હતી કે શહેરની સગવડો (ફિસિલિટીસ) અને પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર્સમાં શહેરના બધાં તહેવારો, આયોજનો, કાર્યક્રમો અને સામુદાયિક આયોજનો માટેની પરવાનગીઓ જુલાઈ 1, 2020 સુધી રદ કરવામાં આવી છે. આ માર્ચ 27, 2020 નાં રોજ કરવામાં આવેલી ઘોષણા પછીની વાત છે કે સીટી હોલ અને સીટી ઓફ બ્રેમ્પટનની બીજી બધી સગવડો COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મેળવવા આગળ નોટિસ આપવામાં ના આવે ત્યાં સુધી બંધ રહેશે.

સીટી અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓ આપવાનું ચાલુ રાખશે જેમાં નીચેની બાબતો સામેલ છે: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, ટ્રાન્ઝિટ, બાય-લો એન્ફોર્સમેન્ટ (કાયદાકીય અમલ-બજાવણી), પ્રાણીઓ સંબંધિત સેવાઓ, સરકારી કામોનું સંચાલન અને જાળવણી, પાર્ક્સ અને ફોરેસ્ટરી સંચાલન, સુરક્ષા સેવાઓ, સાર્થક પ્લાન એપ્લિકેશન્સ, બિલ્ડિંગ પરવાનગીઓ/નિરીક્ષણો, ઓફિસિયલ પ્લાન એમેન્ડમેન્ટ્સ (OPAs) અને રિઝોનિંગ પ્લાનિંગ એપ્લિકેશન્સ, 311 અને વહીવટી/ટેકનિકલ કામગીરીઓ.

સૌથી તાજેતરની અદ્યતન માહિતીઓ અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) માટે, કૃપા કરી વેબસાઈટ જુઓ:

[www.brampton.ca/COVID19](http://www.brampton.ca/COVID19).

### અવતરણો (ક્વોટ્સ):

“આ નિશંકપણે સીટીએ જોયેલા સૌથી પડકારભર્યા સમયમાંનો એક સમય છે, જેને લીધે આપણે કડક પરંતુ જરૂરી નિર્ણયો લેવા પડ્યા છે. શહેરની સગવડો બંધ થવાનું લંબાવવાનો અર્થ અમારા દ્વારા ચલાવાતા કાર્યક્રમો અને અપાતી સેવાઓમાં ફેરફાર થવાનો થાય છે. અમારું ધ્યાન કાયમી પ્રતિભાવ આપવા પર રહ્યું છે જે આ મહામારીના લાંબા-ગાળાના, નકારાત્મક પ્રભાવો ઓછાં કરે છે જેનાથી અમને આપણાં સમુદાયની સુરક્ષાનું સંરક્ષણ કરવામાં અને રહેવાસીઓ અવલંબિત હોય તેવી અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓ આપવામાં મદદ મળી શકે છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“દેશભરની ઘણી સંસ્થાઓની જેમ, અમે આ કટોકટીના વિવિધ પ્રભાવો સામે પ્રતિક્રિયા કરી રહ્યાં છીએ અને પ્રભાવો ઘટાડી રહ્યાં છીએ. અમે એ ખાતરી કરાવવા કટિબદ્ધ છીએ કે કર્મચારીઓ આ સમયે જરૂરી સહાયતા સેવાઓની પહોંચ ધરાવતા હોય. હું દરેક વ્યક્તિને એ ખાતરી કરાવવા પણ ઈચ્છું છું કે આ મુશ્કેલભર્યો નિર્ણય COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં બધી બિન-અનિવાર્ય સેવાઓ બંધ કરવાના અને રદ કરવાના સીધા પરિણામ સ્વરૂપે લેવામાં આવ્યો છે અને અમારી ટીમનો મૂલ્યવાન ભાગ એવા પ્રભાવિત થયેલા કર્મચારીઓના જ્ઞાને પ્રતિબિંબિત કરતો નથી.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

**मिडिया संपर्क :**

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाट

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)